

August 03, 2023

To,
Corporate Relations Department
BSE Limited
2nd Floor, P.J. Towers,
Dalal Street,
Mumbai - 400 001
SCRIP CODE : 543288

To,
Corporate Relations Department
National Stock Exchange of India Limited
Exchange Plaza, Plot No. C/1, G-Block,
Bandra Kurla Complex, Bandra (E),
Mumbai - 400 051.
SYMBOL : DEEPINDS

Sub: Newspaper Advertisement for the Un-audited Financial Results (Standalone & Consolidated) of the Company for the quarter ended June 30, 2023.

Dear Sir/ Madam,

With reference to the captioned subject, please find enclosed herewith copies of Newspaper Advertisements published in the Business Standard - English and Jai Hind - Gujarati on August 03, 2023 in terms of Regulation 30 & 47 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 for the Un-audited Financial Results (Standalone & Consolidated) of the Company for the quarter ended June 30, 2023.

The said copies of newspaper advertisement are also available on website of the Company i.e. www.deepindustries.com.

You are requested to take the same on your records.

Thanking you,

Yours faithfully,

For, Deep Industries Limited


Rohan Shah
Whole Time Director (Finance) & Chief Financial Officer
DIN: 09154526



Encl: as above

DEEP INDUSTRIES LIMITED

CIN: L14292GJ2006PLC049371 REGI. OFFICE : 12A & 14, ABHISHREE CORPORATE PARK, AMBLI BOPAL ROAD, AMBLI, AHMEDABAD - 380058
Ph: 02717-298510 Fax: 02717-298520, E-mail: cs@deepindustries.com website: www.deepindustries.com

STATEMENT OF UN - AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED ON 30TH JUNE, 2023 (₹ In Lakhs)

Sr No	Particulars	Standalone				Consolidated			
		Quarter ended		Year ended		Quarter ended		Year ended	
		30.06.2023	31.03.2023	30.06.2022	31.03.2022	30.06.2023	31.03.2023	30.06.2022	31.03.2022
		Unaudited	Audited	Unaudited	Audited	Unaudited	Audited	Unaudited	Audited
1	Total Income from Operations (net)	9,453.73	9,416.19	6,248.28	32,159.59	10,892.50	10,861.57	7,547.54	35,258.54
2	Net Profit / (Loss) for the period before Tax, Exceptional items	3,154.95	3,107.39	2,068.56	10,456.11	3,794.16	3,532.66	2,480.05	10,686.52
3	Net Profit / (Loss) for the period before tax (after Exceptional items)	3,154.95	3,107.39	2,068.56	10,456.11	3,895.66	8,001.56	2,480.05	15,165.42
4	Net Profit / (Loss) for the period after tax (after Exceptional items)	2,360.92	2,335.98	1,543.61	7,830.84	3,101.63	7,225.91	1,951.14	12,529.92
5	Total Comprehensive Income for the period (Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax))	2,360.92	2,340.15	1,543.61	7,835.01	3,101.63	7,935.28	1,951.14	13,239.29
6	Equity Share Capital (Face Value of ₹ 10/- per share)	3,200.00	3,200.00	3,200.00	3,200.00	3,200.00	3,200.00	3,200.00	3,200.00
7	Other Equity				113,192.50				
8	Earning per share of ₹ 10/- each (from Continuing and Discontinuing Operations)								
	Basic (in ₹)	3.69	3.65	2.41	12.24	4.85	11.29	3.05	19.58
	Diluted (in ₹)	3.69	3.65	2.41	12.24	4.85	11.29	3.05	19.58

Notes:
1) The above is an extract of the detailed format of quarter ended financial results filed with the Stock Exchanges under Regulation 33 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The Full format of the Un-audited financial results for the quarter ended June 30, 2023 are available on the Stock Exchange website (www.bseindia.com and www.nseindia.com) and on the Company's website (http://www.dolphinoffshore.com).
2) The above standalone and consolidated financial results have been reviewed by the Audit Committee and thereafter approved by the Board of Directors of the Company in their respective meetings held on August 01, 2023. The statutory auditors of the company have carried out audit of aforesaid results as per Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015
3) Figures of previous reporting periods have been regrouped/ reclassified wherever necessary to correspond with the figures of the current reporting period.

For, DEEP INDUSTRIES LIMITED
Sd/-
Paras Sawla
Chairman & Managing Director
(DIN: 00145639)

Place : Ahmedabad
Date : 1st August 2023

ਪੰਜਾਬ ਨੈਸ਼ਨਲ ਬੈਂਕ Punjab National Bank

Circle SASTRYA Centre : 1st Floor, Meghani Tower, Station Road, Surat, Gujarat Ph. : 0261-2454543 Email: cs8323@pnb.co.in

APPENDIX IV (See Rule 8 (1)) POSSESSION NOTICE (For immovable property) (Physical)

Whereas, the undersigned being the Authorized Officer of the Punjab National Bank under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest (Second) Ordinance, 2002 (Ord. 3 of 2002) and in exercise of Powers conferred under Section 13(12) read with Rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002, issued a demand notice dated 24.06.2023 calling upon the borrowers/mortgagor Mr. Vipulbhai Nanjibhai Sarkheliya S/O Mr. Nanjibhai Sarkheliya & Mrs. Dayaben Vipulbhai Sarkheliya (Borrower) to repay the amount mentioned in the notice being Rs. 17,41,281.00 (Rupees Seventeen Lac Forty One Thousand Two Hundred Eighty One Only) as on 30/04/2021 and further interest with monthly rest and other charges and expenses within 60 days from the date of notice/date of receipt of the said notice.

The borrowers having failed to repay the amount, notice is hereby given to the Borrower/Guarantor/Mortgagor and the public in general that the undersigned has taken possession of the property described herein below in exercise of powers conferred on him/her under Section 13(4) of the said Act read with Rule 8 of the Security Interest (Enforcement) Rules, 2002 on this 02nd day of August of the year 2023.

The Borrowers/Mortgagor in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of the Punjab National Bank for an aggregate amount of Rs. 17,41,281.00 (Rupees Seventeen Lac Forty One Thousand Two Hundred Eighty One Only) as on 30/04/2021 and further interest thereon.

The borrower's attention is invited to provision of sub-section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured asset.

Description of Immovable Property
All the Right and Interest in the Property Bearing Plot No. 153 as per site Admeasuring 75.00 sq yard alongwith margin and as per K/P Block No. 54/153 admeasuring 62.86 sq.mtrs in the residential which is known as "SHIV VATIKA RAW HOUSE" alongwith undivided proportionate share admeasuring 30.75 sq.mtrs in roadesta and COP in the said residential situated at Revenue Survey No. 60, Its Block No. 54 admeasuring He-1.93 Areas 83 sq.mts i.e. 19933 sq.mts of village Makna Sub Dist. Kamrej, Dist. Surat. Owned by Mr. Vipulbhai Nanjibhai Sarkheliya S/O Mr. Nanjibhai Sarkheliya & Mrs. Dayaben Vipulbhai Sarkheliya. Bounded: North: Road. East: Plot No. 154, South: Adji. Plot, West: Plot No. 152.

Date : 02/08/2023 | Place : Surat | Authorised Officer, Punjab National Bank

HDFC BANK HDFC Bank Ltd.

Branch Address : HDFC Bank, Trident, Race Course, Vadodara-390007. Tel. : 079-64807999

NOTICE FOR REMOVAL OF PERSONAL BELONGINGS/ HOUSEHOLD GOODS

Sr. No.	Name of Borrower(s)/ Legal Heir(s) / Legal Representative(s)	Date of Demand Notice	Date of Possession Physical/Symbolic	Description of Immovable Property(ies) / Secured Asset(s)
(a)	(b)	(c)	(d)	(e)
1	MRS. MADHUBEN C. PATEL (Borrower) MR. CHANDUBHAI D. PATEL (Co-Borrower)	04-Sep., 2008	05-Feb., 2009 Physical Possession	301, DARSHANAM FLATS, PLOT NO.-24, C.S.-1140, F.P.-24, B/H ISCON TEMPLE, OPP. HIRAN BUNGLOWS, V. V. NAGAR, ANAND-388120.
2	MR. NIRAV NARENDRABHAI BRAHMBHATT (Borrower) MRS. RANJANBEN NARENDRABHAI BRAHMBHATT (Co-Borrower) MR. NARENDRABHAI BRAHMBHATT (Co-Borrower)	15-Oct., 2020	09-April, 2023 Physical Possession	68, PRANJAL RESIDENCY, (R. S. NO.1409 & 1412), KARAMSAD-SANDESAR ROAD, WAY TO MOCHIKI ROAD, KARAMSAD, ANAND-388001.
3	MR. NILESH V. PANCHAL (Borrower) MRS. SAPNABEN PANCHAL (Co-Borrower)	10-June, 2022	27-Feb., 2023 Physical Possession	FLAT-402, 4TH FLOOR, RAJESHWAR GALAXY TOWER-B9, S. NO. 1047/1, 2, 3, 4 B/S RAJESHWAR GOLD, NR. VALAM HALL, HARNI GOLDEN CHOWKADI ROAD, VADDODARA-390022
4	LATE MR. MANISH C. CHAUHAN (Borrower)	10-June, 2022	27 Mar., 2023 Physical Possession	FLAT - B-103, 1ST FLOOR, AKRUTI LIFESTYLE TOWER - B, S. NO. 125, NR. LAWKUSH SOCIETY, VADARS VILLAGE ROAD, VADSAR, VADODARA - 390013.

Whereas the undersigned being the Authorized Officer of HDFC Bank Limited (erstwhile HDFC Limited) having amalgamated with HDFC Bank Limited by virtue of a Scheme of Amalgamation approved by Hon'ble NCLT-Mumbai vide order dated 17th March 2023 (HDFC).

This Public Notice is issued in view of the fact that HDFC has not been able to communicate / establish contact with the aforesaid Borrower(s) / Legal Heir(s) / Legal Representative(s) at his / her / their last known address as per HDFC's records. Whereas the Authorized Officer of HDFC in exercise of powers conferred under Section 13(2) of the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act 2002 (SARFAESI Act) has issued Demand Notice (s) to the Borrower (s) / Legal Heir(s) / Legal Representative(s) on the dates mentioned above.

On the Borrower (s) / Legal Heir(s) / Legal Representative(s) failure to comply with the said Demand Notice (s) within the period set out therein, the Authorized Officer of HDFC has taken over possession of the immovable property (ies) / Secured Asset (s) more particularly described in the said Demand Notice (s), under Section 13 (4) of the SARFAESI Act read with Rule 8 of Security Interest (Enforcement) Rules, 2002, on the dates mentioned above.

At the time of taking over possession of the said immovable property (ies) / Secured Asset (s), the Authorized Officer of HDFC has drawn up an inventory of personal belongings and household goods lying therein, copy whereof can be collected from the undersigned on any working day during office hours.

In the circumstances, Notice is hereby given, to the said Borrower (s) / Legal Heir(s) / Legal Representative(s) to forthwith remove the personal belongings / household goods lying in the aforesaid immovable property (ies) / Secured Asset (s) within 7 (SEVEN) days from the date hereof, failing which the Authorized Officer will have no other option but to remove the personal belongings/household goods and dispose off deal with it in the manner as may be deemed fit, entirely at the Borrower (s) / Legal Heir(s) / Legal Representative(s) risk as to cost and consequences, in which event, no claim will be entertained in this regard in future.

Date : 02-08-2023
Place : Vadodara
For, HDFC Bank Ltd. Sd/- Authorised Officer

Regd. Office : HDFC Bank Ltd. HDFC Bank House, Senapati Bapat Marg, Lower Parel (West), Mumbai-400013. CIN : L65920MH1994PLC080618, Website : www.hdfcbank.com

Indian Bank

Surat Main Branch : Shop No. 12-15, Reshanwala Market, Ring Road Surat (Gujarat) - 395002.

POSSESSION NOTICE (FOR IMMOVABLE PROPERTY)

Whereas, the undersigned being the authorized officer of Indian Bank under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and in exercise of the powers conferred to him under Section 13(12) read with rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 issued a demand notice dated 02/05/2023 calling upon M/S VAMAN FASHION (Proprietorship Firm), Mr. Bastiram Kamal Hiragar (Proprietor & Borrower) & Mr. Pratapram Ramilal Hiragar (Ramalal and Mortgagor) to repay the amount mentioned in the notice being to Rs. 1,70,82,841.84 (Rupees One Crore Seventy Lakhs Eighty Two Thousand Eight Hundred and Forty One Paise Eighty Four Only) as on 01/05/2023 + further interest and other expenses within 60 days from the date of receipt of the said notice.

The Borrower/Guarantor having failed to repay the amount, notice is hereby given to the borrowers and the guarantors and the public in general that the undersigned has taken Possession of the property described herein below in exercise of the powers conferred on him under section 13(4) of the said Act read with rule 8 of the said rules on 1st day of August of the year Two Thousand Twenty Three.

The borrowers/guarantors in particular and the public in general are hereby cautioned not to deal with the properties and any dealings with the properties will be subject to the charge of Indian Bank, SURAT MAIN for an amount of Rs. 1,70,82,841.84 (Rupees One Crore Seventy Lakhs Eighty Two Thousand Eight Hundred and Forty One Paise Eighty Four Only) as on 01/05/2023 + further interest and other expenses thereon.

The Borrower's attention is invited to provision of sub-section (8) of section 13 of the Act, in respect of the time available, to redeem the secured assets.

DESCRIPTION OF THE IMMOVABLE PROPERTIES
Schedule A : Plot No. 8, C Type, admeasuring area 58.44 Sq. ft. along with undivided proportionate share in the underneath land of the society known and name as Priyanka Intercity situated at Mogob, land bearing Revenue Survey No. 34/7, Block No. 53/1+2, Village Mogob, Taluka Puna, District Surat. The boundaries of the Property are: North: C Type Plot No. 7, South: C Type Plot No. 9, East: Land of Block No. 52, West: Society Road.
Schedule B : Plot No. 53 (as per Re-Survey, New Block No. 633) area admeasuring 149.00 Sq. Mtrs i.e. 178.00 Sq. Yards along with undivided proportionate share admeasuring 52.15 Sq. Mtrs. in the common Roads and COP (aggregating 201.15 Sq. Mtrs) of Heritage Homes land bearing Old Block No. 9/B, Revenue Survey No. 6, 15 and 13 of Village Ladvi, Taluka Kamrej, Dist. Surat. The boundaries of the Property are: North: Adji. C. O. P., South: Plot No. 52, East: Society Road, West: Plot No. 38.

DESCRIPTION OF THE MOVABLE PROPERTY
Schedule C : Stock of Sarees stored at Shop No. W-3203, 2ndFloor, Surat Textile Market, Umarwada, Ring Road, Surat-395002.

Date: 01/08/2023
Place: Surat
Authorized Officer, Indian Bank, SURAT MAIN Branch.

The Jain Sahakari Bank Ltd.

(Multi State Co-Operative Bank)
Regd. Office : Hira Baug, Khattarali Lane, C.P. Tank Mumbai-400 004. Tele Fax : 022-2386 8550
E-mail : ceo@jainbank.co.in

Paldi Branch : Shop No. 5A, 6A, 7A, Ashirwad Shopping Centre, Pritam Nagar, Paldi, Ahmedabad-380 006. Tel : 079-26576474
E-mail : jsbl_paldi@jainbank.co.in

APPENDIX II (See rule 4 (2)) Inventory
Inventory of movables taken possession in Loan Account bearing No.006030367000008 at the premises of M/s. Shreeji Plastic Industries, 4 Mahalaxmi Compound, Near Khodal Hotel, Kothari Char Rasta, Vill Santaj Tal Kalol Dist Gandhinagar under Section 13(4) of the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest (Second) (Act), 2002 (54 of 2002) and the Security interest (Enforcement) Rules, 2002 made thereunder, on this 27th day of July 2023 by authorized officer of The Jain Sahakari Bank Ltd., Paldi Branch under the said (Act), between the hours 1.30 p.m. to 1.45 pm.

S.No.	Description of article	Estimated value (Rs.in lacs)	Place where kept for safe custody
(1)	Plastic Extruder with Semi Automatic Recycling Plant local make	Rs.8.00	4 Mahalaxmi Compound, Near Khodal Hotel, Kothari Char Rasta, Vill Santaj Tal Kalol, Dist Gandhinagar
(2)	Plastic Grinder local make		

Sr. No. Name and Address of Panch
(1) Sandeep Nagorav Khandare
B-250 Part -7 Parshwanath Township Krishnanagar, New Naroda, Ahmedabad (Guj)
(2) Tejas Mansukhbhai Jadav
381, Samratnagar, Hansol, Ahmedabad (Guj)

Drawn by me today the 27th day of July 2023 at Ahmedabad
In Between 1.30 P.M to 1.45 P.M
Signature of Authorized Officer
FOR THE JAIN SAHAKARI BANK LIMITED

JHAVERI JHAVERI CREDITS AND CAPITAL LIMITED

CIN:L65910GJ1993PLC020371 • Regd. Office - 301 Payal Towers-II, Sayajigunj, Vadodara-390020
Phone: +91 265 6161200 | Website: www.jhavericommodity.com | E-mail: companysecretary@jhaveritrade.com

NOTICE OF 29TH ANNUAL GENERAL MEETING AND REMOTE E-VOTING INFORMATION

NOTICE is hereby given that the 29th Annual General Meeting ("AGM") of Jhaveri Credits and Capital Limited will be held on Friday, August 25, 2023 through Video Conference ("VC") / Other Audio Visual Means ("OAVM") at 04:00 p.m. The venue of the Meeting shall be deemed to be the Registered Office of the Company i.e. 301, Payal tower-II, Sayajigunj, Vadodara - 390 020.

In accordance with the Applicable Circular issued by the Ministry of Corporate Affairs (MCA) and the Securities Exchange Board of India (SEBI), the Notice of AGM and Annual Report including the Audited Financial Statements for the financial year 2022-23 have been sent in electronic mode to Members whose e-mail IDs are registered with the Company or the Depository Participant(s). The electronic dispatch of Annual Report to Members has been completed on August 2, 2023. The copy of the Annual Report is also available on the Company's website www.jhavericommodity.com, the documents pertaining to the items of business to be transacted in the AGM shall be available for inspection upon login at NSDL e-voting system at https://www.evoting.nsdl.com.

INSTRUCTIONS FOR REMOTE E-VOTING AND E-VOTING DURING AGM:

Pursuant to Section 108 of the Companies Act, 2013 read with Rule 20 of the Companies (Management and Administration) Rules, 2014 and Regulation 44 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, the Company is pleased to provide the facility to Members who hold the share either in physical or dematerialized form as on Friday, August 18, 2023 (cut-off date) and whose names are recorded in the Register of Members or in the Register of Beneficial Owners maintained by the Depositories as on the cut-off date, the right to vote by electronic means on resolutions proposed to be passed at AGM through electronic voting system (remote e-voting) of NSDL at https://www.evoting.nsdl.com/. All the Members are hereby informed that the Ordinary Businesses, as set out in Notice of 29th AGM, will be transacted through voting by electronic means only.

The remote e-voting period will commence at 9:00 a.m. on Tuesday, August 22, 2023 and will end at 5:00 p.m. on Thursday, August 24, 2023. Once the vote on a resolution is cast by the member, the member cannot modify it subsequently.

Members who have acquired shares after dispatch of the Annual Report through electronic means and before the cut-off date are requested to refer to the Notice of AGM for the process to be adopted for obtaining the USER ID and Password for casting the vote.

Members attending the AGM, who have not cast their vote by remote e-voting shall be eligible to cast their vote through e-voting during the AGM. Members who have voted through remote e-voting shall be eligible to attend the AGM, however, they shall not be eligible to vote at the meeting.

The procedure of electronic voting is available in the Notice of the AGM as well as in the email sent to the Members by NSDL. In case of any queries/grievances, you may refer to the 'Frequently Asked Questions' (FAQs) for Members and 'e-voting user manual' for Members available in the download section of the e-voting website of NSDL https://www.evoting.nsdl.com/. Members, who need assistance before or during the AGM with use of technology, can send a request at evoting@nsdl.co.in or use Toll free no.: 1800 1020 990 and 1800 22 44 30.

The Notice of AGM is available on the Company's website www.jhavericommodity.com, on the website of Stock Exchange i.e. BSE Limited and on the website of NSDL at www.evoting.nsdl.com.

Manner of registering/updating email addresses	Manner of joining the AGM
Members who have not registered / updated their email addresses with the Company are requested to update their email addresses as follows: a) Shares held in physical mode: provide Folio No., Name of shareholder, scanned copy of the share certificate (front and back), PAN (self attested scanned copy of PAN card), AADHAAR (self attested scanned copy of Aadhaar Card) by email to: companysecretary@jhaveritrade.com; b) Shares held in demat mode: provide DPID-CLID (16 digit DPID + CLID or 16 digit beneficiary ID), Name, client master or copy of Consolidated Account statement, PAN (self attested scanned copy of PAN card), AADHAAR (self attested scanned copy of Aadhaar Card) to : companysecretary@jhaveritrade.com; c) Alternatively shareholder/members may send a request to evoting@nsdl.co.in for procuring user ID and password for e-voting by providing above mentioned documents.	Members may access by following the steps mentioned in Notice of AGM under Access to NSDL e-Voting system. After successful login, you can see link of "VC/OAVM link" placed under "Join General meeting" menu against Company name. Click on VC/OAVM link placed under Join General Meeting menu. The link for VC/OAVM will be available in Shareholder/Member login where the EVEN of Company will be displayed. Please note that the members who do not have the User ID and Password for e-Voting or have forgotten the User ID and Password may retrieve the same by following the remote e-Voting instructions mentioned in the notice to avoid last minute rush.

Place: Vadodara
Date: August 03, 2023
For Jhaveri Credits and Capital Limited Sd/-
Kamlesh J. Jhaveri, Wholtime Director (DIN:00266242)

Bank of Baroda Alladra Branch: Ground Floor, Apex the Landmark, Alladra Sun Pharma Road Vadodara- 390012 India. Ph.: 0265-2681315 | Email: atlada@bankofbaroda.com

POSSESSION NOTICE (For Immovable Property) APPNDIX IV (See Rule 8 (1))

Whereas, the undersigned being the Authorized Officer of Bank of Baroda, under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and in exercise of powers conferred upon me under section 13(12) read with Rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002, issued a Demand Notice dated 12.05.2023 calling upon the Borrower, Mr. Kushan Satishbhai Kharacharya to repay the amount mentioned in the notice being of Rs. 5,73,221.10/- (Rupees Five Lakh Seventy Three Thousand Two Hundred Twenty One Paise Ten Only) as on 08.05.2023 together with further interest thereon at the contractual rate plus costs, charges and expenses till the date of payment within 60 days from the date of receipt of the said notice. The Borrowers/Guarantors/Mortgagors having failed to repay the amount, notice is hereby given to the Borrowers/Guarantors/Mortgagors and the public in general that the undersigned has taken possession of the property described herein below in exercise of powers conferred on me under Section 13(4) of the said Act read with Rule 8 of the said rules on this 28th day of July the year 2023. The Borrowers/Guarantors/Mortgagors in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of the Bank of Baroda. For an amount of being Rs. 5,73,221.10/- (Rupees Five Lakh Seventy Three Thousand Two Hundred Twenty One Paise Ten Only) as on 08.05.2023 plus reversal amount of unrealized interest plus unapplied interest plus other charges if any. The Borrowers' attention is invited to provision of sub-section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.

Description of Immovable Property
The property being Registration District Vadodara, Sub District Vadodara Village Vadodara City, City Survey No. 22/A/R/K, Vihang-A, Tikka No. 9/1 total admeasuring 374.94 sq. mtrs. land in that 4th floor, Flat No. 403, Having 400 sq.ft.s. Super built up construction in Ganadish Complex, Pomi Talaiya, Wadi, Vadodara. Bounded by: East by: Flat No. 404, West by: Flat No. 402, North by: Main Road, South by: Stair Case
Date: 28.07.2023, Place: Vadodara
Authorised Officer, Bank of Baroda

HDFC BANK HDFC Bank Ltd. POSSESSION NOTICE

Branch Address: HDFC Bank, Trident, Race Course, Vadodara-390007. Tel. : 079-64807999

Whereas the Authorized Officer of HDFC Bank Limited (erstwhile HDFC Limited) having amalgamated with HDFC Bank Limited by virtue of a Scheme of Amalgamation approved by Hon'ble NCLT-Mumbai vide order dated 17th March 2023, (HDFC) under Securitization And Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and in exercise of powers conferred under Section 13 (12) read with Rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 issued Demand Notices under Section 13 (2) of the said Act, calling upon the following borrower(s) / Legal Heir(s) and Legal Representative(s) to pay the amounts mentioned against their respective names together with interest thereon at the applicable rates as mentioned in the said notices, within 60 days from the date of the said Notice(s), incidental expenses, costs, charges etc till the date of payment and / or realization.

Sr. No.	Name Of Borrower (S) / Legal Heir(S) And Legal Representative(S)	Outstanding Dues (Rs.)	Date Of Demand Notice	Date Of Possession Physical/ Symbolic	Description Of Immovable Property (ies) / Secured Asset (S)
(a)	(b)	(c)	(d)	(e)	(f)
1	MRS. SARIFABANU SARFARAZ SHAIKH (BORROWER) MR. MOHAMMAD ALI IBRAHIM SHAIKH (CO-BORROWER) MR. SARFARAZ MOHAMMAD SALIM SHAIKH (CO-BORROWER) MS. NEW GUJARAT TRANSPORT (CO-BORROWER) 123823 - 647007025 and 645484444	Rs.4,65,537/- and Rs.1,71,62,358/- Respectively as on 31 Aug., 2021*	21 Nov., 2022	01 Aug., 2023 Symbolic	UNIT - E-11, 12, 13, 14, 15, 4TH FLOOR, SIGNATURE GALLERIA, S. NO. 466 PAIKI, WEST SIDE, NR. MAHAVIR CROSSING, OPP. RAILWAY CONTAINER YARD, OLD NH-8, ANKLESHWAR - 393001.
2	MR. MOHAMM SEHBAZ JAMADAR (BORROWER) 147070 - 626183300 and 614007067	Rs.3,41,751/- and Rs.2,37,130/- Respectively as on 31 Aug., 2022*	10 Oct., 2022	01 Aug., 2023 Symbolic	FLAT NO. A-2/206, 2ND FLOOR, NOOR-E-EHLAH APARTMENT-TYPE - A1 & A2, R.S. 251/7, SUB PLOT 1 & 2, NR. ROSHAN PARK, AMBOLI ROAD, OFF - HANSOT ROAD, ANKLESHWAR - 393001.
3	MR. DHIRENDRAKUMAR GANESHAL VARMA (BORROWER) 149784 - 622085587	Rs.9,49,349/- as on 28 Feb., 2023*	22 Mar., 2023	01 Aug., 2023 Symbolic	FLAT NO. C-104, 1ST FLOOR, SAGAR RESIDENCY, R.S. NO. 2791-2, PLOT NO. 66/1, OPP. KRISHNA PARK, NR. KAPODARA PATIA, VALIA ROAD, ANKLESHWAR -393001.
4	MR. RAMPRAVESH SHIVNATH YADAV (BORROWER) 149779 - 607564184	Rs.6,17,154/- as on 28 Feb., 2023*	22 Mar., 2023	01 Aug., 2023 Symbolic	C-138, RADHE KRISHNA RESIDENCY, R.S. 447/1, NR. RADHE PARK, NR. SAHJANAND PARK, KAPODARA PATIA, VALIA ROAD, ANKLESHWAR - 393002.

* with further interest as applicable, incidental expenses, costs, charges etc. incurred till the date of payment and/or realization.

However, since the borrower(s) / Legal Heir(s) and Legal Representative(s) mentioned hereinabove have failed to repay the amounts due, notice is hereby given to the borrowers / Legal Heir(s) and Legal Representative(s) mentioned hereinabove in particular and to the public in general that the Authorized Officers of HDFC (erstwhile HDFC Limited) having amalgamated with HDFC Bank Limited by virtue of a Scheme of Amalgamation approved by Hon'

